

# S.D.ARTS & B.R.COMMERCE COLLEGE,MANSA

## UGBA SEM-V[Gujarati] core Paper-305/A

MCQ- Prepared By Assi. Prof. Hemlataben B. Mehta

પ્રશ્નોનો અને તેનાં જવાબ

૧. શામળ ભટ્ટના જન્મનું સ્થળ જણાવો. - વેંગણપુર (હાલ ગોમતીપુર)
૨. શામળ કઈ જ્ઞાતિના હતા? - શ્રીગોળ માળવી બ્રાહ્મણ
૩. શામળના પિતાનું નામ જણાવો. - વીરેશ્વર
૪. શામળની માતાનું નામ જણાવો. - આનંદીબાઈ
૫. શામળના પુત્રનું નામ જણાવો. -પુરુષોત્તમ
૬. શામળના ગુરુનું નામ જણાવો. - નાનાભટ્ટ
૭. શામળે જીવનનિર્વાહ માટે કોનો આશ્રય સ્વીકાર્યો હતો? - રખીદાસ
૮. 'વાણિયાનો કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે? - શામળને
૯. શામળે કોનું ઋણ સ્વીકાર્યું છે? - પુરોગામીઓનું
૧૦. શામળની પદ્યવાર્તામાં છપ્પા ઉપરાંત શેનું આલેખન થયું છે? - સમસ્યાઓ
૧૧. 'સાદી ભાષા, સાદી કડી,સાદી વાત વિવેક .... આ કથન કયા કવિનું છે? - શામળ
૧૨. અમદાવાદના વેંગણપુરમાં વસેલા અને પિતા વીરેશ્વરનાં કવિપુત્રનું નામ શું હતું? - શામળ
૧૩. શામળનું મોટા ભાગનું સર્જન કયા સ્વરૂપમાં જોવા મળે છે? - પદ્યવાર્તામાં
૧૪. શામળની કઈ કૃતિનું કથાનક કાલ્પનિક છે? - 'મદનમોહના'
૧૫. પદ્યવાર્તા કયાંથી ઉતરી આવી છે? - સંસ્કૃત કથાસાહિત્યમાંથી
૧૬. 'શામળને મન કાવ્યરસ નહીં પણ કથારસ જ મુખ્ય રહ્યો છે'-આ વિધાન કોનું છે? - અનંતરાય રાવળ
૧૭. પદ્યવાર્તા ક્ષેત્રે કોનું પ્રદાન મહત્વનું છે? - શામળ
૧૮. શામળ પછી કયા સાહિત્ય સ્વરૂપનો પ્રવાહ સાવ સુકાઈ ગયેલો જણાય છે ? - પદ્યવાર્તા
૧૯. શામળની પદ્યવાર્તાઓમાં નાવિકાનું પાત્ર નાયક કરતા કેવું હોય છે - ચડિયાતું
૨૦. પદ્યવાર્તાઓ ઉપરાંત શામળની બીજી વિશેષતા શી છે ? - છપ્પા
૨૧. શામળ ભટ્ટનો વ્યવસાય જણાવો. - કથાકાર
૨૨. શામળની અંતિમ કૃતિનું નામ જણાવો. - 'સુડાબહોતેરી'
૨૩. શામળ વેંગણપુર છોડી કયાં આવીને વસ્યા હતા? - સિંહજ
૨૪. શામળના જીવનનું મોટામાં મોટું સર્જન કઈ કૃતિને કહેવામાં આવે છે? - 'સિંહાસનબત્રીસી'
૨૫. શામળની પદ્યવાર્તાઓની સૃષ્ટિ કયા રસથી સભર છે? - અદભુત રસથી
૨૬. શામળની પદ્યવાર્તાઓમાં કેવા પ્રકારનાં સ્ત્રીપાત્રોનો સમાવેશ થાય છે? - રાજકુમારીઓ અને માલણોનો
૨૭. પદ્યવાર્તાને કોણે વધારે પ્રમાણમાં પ્રયોજી છે? - જૈન અને જૈનેતર કવિઓ
૨૮. 'નંદબત્રીસી' પદ્યવાર્તાના સંપાદકનું નામ જણાવો - ડૉ.કીર્તિદાબેન શાહ
૨૯. 'નંદબત્રીસી' કુલ કેટલી કડીમાં લખાયેલી કૃતિ છે? - ૪૬૨
૩૦. 'નંદબત્રીસી' પદ્યવાર્તાના પ્રારંભમાં શામળ નંદસેન રાજાને કોની સાથે સરખાવે છે? - રાજા ભોજ
૩૧. પ્રધાન વૈરોચનની પત્નીનું નામ જણાવો - પદ્મિની
૩૨. 'નંદબત્રીસી'માં શામળે કેવી ભાષા પ્રયોજી છે? - સાદી,સીધી,સહજ અને સરળ
૩૩. પ્રધાન વૈરોચનનો સ્વભાવ કેવો હતો? - શંકાશીલ
૩૪. નંદરાજા પ્રધાનને ઘોડા ખરીદવા માટે કયાં મોકલે છે? - કચ્છમાં
૩૫. 'જેહ ઢાંકણ જગતાં વીખે,અંગ સમારે તાહરું તેહને નીત અમે સંમારીયે રે,સમજ નામ તે માહરું' - આ પંક્તિ કોણ બોલે છે? - ઘોબી

૩૬. નંદરાજાનાં પ્રધાનનું નામ જણાવો. - વૈરોચન
૩૭. પ્રધાનના મહેલમાં પ્રવેશ કરવા માટે નંદરાજા દ્વારપાળને કઈ વસ્તુ આપે છે? - સોનાના કુંડલ
૩૮. 'કુણ છે રે ભાઈ મઝમ રાત, જે હોય તે આવ્યજે પરભાત' - આ પંક્તિ કોણ બોલે છે? - દ્વારપાળ
૩૯. નંદરાજા પ્રધાનના મહેલમા આવે છે ત્યારે પદ્મિની સાથે કોણ હોય છે? - પોપટ
૪૦. ધોબી પદ્મિનીના કપડાં કયા સમયે ધોતો હોય છે? - મધરાતે (મધ્યરાત્રિએ)
૪૧. પ્રધાન વૈરોચનનાં સસરાનું નામ જણાવો. - નેનસુખ
૪૨. પ્રધાન વૈરોચનનાં સસરા કયા નગરમાં રહેતા હતા? - નયનાવતી
૪૩. રાજાનંદની હત્યાની ઘટના વખતે ચંપાના ઝાડ પર કોણ હોય છે? - માળી
૪૪. રાજાનંદની હત્યા કોણે કર્યાની હકીકત માલણ રાજરાણીને કહે છે? - પ્રધાન વૈરોચને
૪૫. નંદરાજાના અસ્થિનું વિસર્જન કઈ નદીમાં કરવામાં આવ્યું હતું? -ગંગા
૪૬. રાજાનંદની હત્યા કર્યા પછી પ્રધાને એનો મૃતદેહ કયા વૃક્ષ પાસે દાટી દીધો હતો? - ચંપાના
૪૭. 'નીલકંઠ કલંક થઈ આવસે તો મારે સિરા પાપ .... આ પંક્તિ પદ્મિની કોને સંબોધીને કહે છે? - અગ્નિને
૪૮. પદ્મિનીના સતીત્વની ખાતરી કઈ ઘટનાથી થાય છે? -નંદરાજા સજીવન થાય છે ત્યારે
૪૯. 'હંસ ગયો સરવર વીખે દીઠું અમૃત વાર, પીધાવણ પાછો વલો રે પડ પાસા પોહોબાર' -આ પંક્તિ કોણ બોલે છે? - નંદરાજા
૫૦. 'મન વિસવાસ રાખો સહુ, પણ આપ બયાં નવ ખાય' - આ પંક્તિ નંદરાજા કોણને કહે છે? - પ્રધાન વૈરોચને